



RAN-2408000602040004

B.Com. (NEP) (Sem. - II) Examination November - 2025
MDC - International Financial Management

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book.
- (2) પ્રશ્ન 1 ફરજિયાત છે.
First Question is compulsory
- (3) જમણી બાજુના અંક પ્રશ્નોના પૂરા ગુણ દર્શાવે છે.
Figures to the right indicate full marks of the questions.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

- પ્ર. 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો (કોઈપણ પાંચ) (10)**
1. આંતરપ્રાદેશિક વેપારનો અર્થ ઉદાહરણ સહિત આપો.
 2. વેપાર તુલા એટલે શું?
 3. જે.એસ.મિલના પારસ્પરિક માંગ સિદ્ધાંતની ધારણાઓ જણાવો.
 4. મુક્ત વેપારનો અર્થ આપો.
 5. દ્રશ્ય અને અદ્રશ્ય નિકાસોના પાંચ ઉદાહરણ આપો.
 6. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળની સ્થાપના ક્યારે થઈ?
 7. ચલણનું અવમૂલ્યન એટલે શું?
- પ્ર. 2. હેકસર ઓલ્લિનના વેપારનો સિદ્ધાંત ટીકાત્મક રીતે સમજાવો. (14)**
- અથવા**
- પ્ર. 2. અ. આંતરરાષ્ટ્રીય વેપારના ફાયદાઓની સમજૂતી આપો. (07)**
- બ. સાધન વિપુલતા વિશે નોંધ લખો. (07)**
- પ્ર. 3. લેણદેણની તુલામાં અસમતુલાના કારણો સમજાવો. તેને નિવારવાના ઉપાયોની ચર્ચા કરો. (14)**
- અથવા**
- પ્ર. 3. અ. સમખરીદ સિદ્ધાંતનું નિરપેક્ષ સ્વરૂપ સમજાવો. (07)**
- બ. વિશ્વ વેપાર સંગઠનના કાર્યોની ચર્ચા કરો. (07)**
- પ્ર. 4. ટૂંકનોંધ લખો (ગમે તે બે) (12)**
1. વિશ્વ બેન્કના કાર્યો
 2. બ્રિટનવુડ એગ્રીમેન્ટ
 3. વેપારની શરતોના પ્રકારો
 4. વિશ્વ વેપાર સંગઠનના સભ્યપદથી ભારતને થતા લાભો.

ENGLISH VERSION

- Q. 1. Answer the following questions in brief (Any five) [10]**
1. Write the meaning of inter regional trade with an example.
 2. What is the balance of trade?
 3. State the assumptions of J.S. Mill's theory of reciprocal demand.
 4. Give the meaning of free trade.
 5. Give five examples of visible and invisible exports.
 6. When was the International Monetary Fund established?
 7. What is currency devaluation?
- Q. 2. Explain Heckscher Ohlin's theory of trade critically. (14)**
- OR**
- Q. 2. A. Explain the advantages of international trade. (07)**
B. Write a note about resource abundance. (07)
- Q. 3. Explain the causes of disequilibrium in the balance of payments. Discuss the measures to overcome it. (14)**
- OR**
- Q. 3. A. Explain the absolute form of the purchasing power parity theory. (07)**
B. Write a note about resource abundance. (07)
- Q. 4. Write short notes (Any two) (12)**
1. Functions of the World Bank
 2. Bretton Woods Agreement
 3. Types of trading terms
 4. Benefits to India from WTO membership
-